



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૬/૧૧/૨૦૧૮ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૭૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૨ કેસ કરી, ૨૮ વ્યક્તિઓને ઝડપી, ૧૬૩ લીટર દેશી દારૂ, ૩૪૯ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૧૭ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ અને અશોક લેલન્ડ ગાડી કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૪ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૫,૧૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૧૭૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૧૭૫/૧૮

સરદારનગર: સજ્જનભાઈ પરીમલ દુરાની (ઉ.વ.૭૨)(રહે. ગીતાપાર્ક સોસાયટી ગુલશન પાર્ટી પ્લોટ સામે “જી” વોર્ડ કુબેરનગર સરદારનગર) એ તા.૫/૧૧/૧૮ નારોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આશરે અઢી વર્ષ પહેલાથી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) રાજુ ઉર્ફે રાજેન્દ્ર ગુરાનાની (૨) સુખદેવ રાજુ ગુરાનાની (૩) બોની રાજુ ગુરાનાની (તમામ રહે.શફલ બંગ્લા એરીયા મધર ડેરી રોડ રાજ ફાર્મની પાછળ હિન્દુસ્તાન પેટ્રોલપંપ પાછળ ભાટ કોસ રોડ ગાંધીનગર) એ ભેગા મળી સજ્જનભાઈને જણાવેલ કે “અમારે ધંધો સારો ચાલે છે અને અમારે ડ્રાયફ્રુટનો સ્ટોક કરવાનો છે જેથી અમારે પૈસાની જરૂર છે અને તમારા પૈસા મકાન વેચાશે એટલે પરત આપી દઈશું” તેમ કહી સજ્જનભાઈનો વિશ્વાસ કેળવી, તેમની પાસેથી ચેકથી અલગ-અલગ સમયે કુલ રૂપિયા ૭,૫૦,૦૦૦/- લઈ જઈ રૂપિયાઆજદીન સુધી પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.ડો એમ.એમ.ઠાકોર ચલાવે છે.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૨૧૭૬/૧૮

નિકોલ: ચીમનભાઈ જગાભાઈ સુથાર(રહે.શ્યામ રેસીડન્સી, ઓડામા મકાનની બાજુમાં વસાણી પાર્ટી પ્લોટ પાછળ નિકોલ) એ તા.૦૫/૧૧/૧૮ નારોજ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૧૦/૧૮ રાતના ૧૧/૦૦ થી તા.૦૫/૧૧/૧૮ કલાક ૨/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના દરવાજા પાસે આવેલ બારી ખોલી, અંદર હાથ નાખી દરવાજો ખોલી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીના લોકરમાંથી (૧) સોનાની કાનની શેર નંગ-૨ કિમત રૂપિયા ૨૦,૦૦૦/- (૨) સોનાની કાનની ગુમ્મર વાળી બુટી નંગ-૨ કિમત રૂપિયા ૨૦,૦૦૦/- (૩) સોનાની વીટી નંગ-૩ કિમત રૂપિયા ૨૦,૦૦૦/- (૪) પંચધાતુ કડુ કિમત રૂપિયા ૩,૦૦૦/- અને રોકડ રૂપિયા ૩૧,૦૦૦/- મળી કુલ રૂપિયા ૯૪,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.વી.છાસટીયા ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૨૧૭૭/૧૮

જી.આઇ.ડી.સી.વટવા: નિલેષભાઈ અંબાલાલ ગુરવ (રહે.શકિતપોળ ગોપાલનગર અમરાઈવાડી) એ તા.૫/૧૧/૧૮ નારોજ જી.આઇ.ડી.સી.વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩/૧૧/૧૮ સાંજના ૭/૦૦ થી તા.૫/૧૧/૧૮ કલાક ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન જીઆઇડીસી વટવા પ્લોટ નંબર-૩૧૦૧ ફેઝ-૪ માં આવેલ "કિષ્ના એજીનીયરીંગ કંપનીની આગળ પાર્ક કરેલ ટાટા સીઝા ગાડીના ટાયર નંગ-૪ કિંમત રૂપિયા ૮૦,૦૦૦/- મતાના કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એન.વાઘેલા ચલાવે છે.

દાઝી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૨૧૭૮/૧૮

અમરાઈવાડી: અશ્મીતાબહેન ડો/ઓ વાડીલાલ મકવાણા (ઉ.વ.૧૭) (રહે. નારણપીઠાની ચાલી અમરાઈવાડી) તા.૨૮/૧૦/૧૮ બપોરના ૩/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે અખંડ દીવો બળતો હતો તેની બાજુમાં બેસી વાચતી હતી અને ઉંઘ આવી જતા ત્યાજ ઉંઘી જતા દીવો નીચે પડતા અશ્મીતાબહેનને પહેરેલ કપડાએ ઝાળ લાગતા દાઝી ગયા હતા. સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૫/૧૧/૧૮ બપોરના ૨/૫૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી સી.પી.રાવ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૧૭૯/૧૮

શાહીબાગ: રાજેશભાઈ વિઠલભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦) (રહે.વણકરવાસ કેમ્પ સદરબજાર શાહીબાગ) એ અગમ્ય કારણસર તા.૫/૧૧/૧૮ સવારના ૧૧/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વસંતભાઈ ચલાવે છે.

કાગડાપીઠ: મીનાબહેન ભરતભાઈ પરમાર (ઉ.વ.૫૦) (રહે. સિવાલય રેસીડન્સી ભુલાભાઈ પાર્ક) એ તા.૪/૧૧/૧૮ બપોરના ૨/૪૫ વાગ્યાના સુમારે માનસિક બિમારીના લીધે પોતાના ઘરે એસીડ પી લીધું હતું. સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એલ.વાઘેલા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.